



Certificate No. 16909  
AN ISO 9001, ISO 14001, ISO 45001  
Certified Company

CIN: L24100GJ2015PLC081941



**DHARMAJ**  
CROP GUARD LIMITED

Limitless  
GROWTH

August 12, 2023

To,

BSE Limited Corporate Relationship Department. PJ Towers, 25th Floor, Dalal Street, Mumbai- 400 001	National Stock Exchange of India Limited Exchange Plaza, Plot No. C/1, G-Block Bandra Kurla Complex, Bandra (East), Mumbai- 400 051.
<b>BSE Scrip Code No. 543687</b>	<b>NSE Symbol: -DHARMAJ</b>

Dear Sir/Madam,

**Sub: Newspaper advertisement - Information regarding 9<sup>th</sup> Annual General Meeting, e-voting and other related information**

Pursuant to Regulation 47 read with Regulation 30 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we are enclosing herewith copies of newspaper advertisement published today i.e., 12<sup>th</sup> August, 2023 in Financial Express (English - All Editions) and Financial Express (Gujarati Edition), which includes the following information:

1. Intimation of 9<sup>th</sup> Annual General Meeting (AGM) of our Company to be held through video conferencing / other audio-visual means and confirmation of dispatch of Annual Report for the Financial Year 2022-23, along with Notice of the AGM.
2. Particulars of the facility of e-voting provided to Members of the Company, to enable them to cast their votes on the resolutions proposed to be passed at the AGM.

We request you to take the above information on records

Thanking you,

For, **Dharmaj Crop Guard Limited**

Malvika

Bhadresh Kapasi

Digitally signed by Malvika Bhadresh Kapasi  
DN: c=IN, ou=Personal, title=9031,  
pseudoym=431A1A45D38528C388FD4D43E438296804FFD45,  
2.5.4.20=3f00767740c9d203559a865ba6d6999cac47dab23804  
4856e48925d46e, postalCode=380052, st=Gujarat,  
serialNumber=7C7ECC69585C31FBA7721898AAEA08651BAE83  
C1289D0d8381854E2CAAD0, cn=Malvika Bhadresh Kapasi  
Date: 2023.08.12 14:30:26 +05'30'

**Malvika Bhadreshbhai Kapasi**  
**Company Secretary & Compliance Officer**  
**A52602**

Encl.: As above

Regd. Office/ Factory Unit-I : Plot No. 408 to 411, Kerala GIDC Estate, Off NH-8, At : Kerala, Ta.: Bavla, Dist.: Ahmedabad- 382220, Gujarat, India. Tel.: 02714-268000

Factory Unit-II : Plot No. DP-154, GIDC-Chemical Zone, Saykha-II, Ta.- Vagra, Dist.- Bharuch – 392140, Gujarat, India.

Corporate Office: Office No. 901 to 903 & 911, B Square 2, Iscon Ambli Road, Ahmedabad- 380058, Gujarat, India. Tel.: 079-29603735 • 02717438189

Email: info@dharmajcrop.com • Web: www.dharmajcrop.com

RATNA DHARMAJ CROP GUARD LIMITED					
CIN: L45200GJ2006PLC048776					
Regd. Office: Ratna Corporate House, Near Santoor Bungalows, Ambli, Daskroi, Ahmedabad-380058, Gujarat, India					
Contact No: +91 87585 51175;   Email: cs@ratnagroup.co.in;   Website: www.ratnagroup.co.in;					
EXTRACT OF UNAUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30TH JUNE, 2023					
(Rupees in Lakhs except EPS)					
Sr. No.	Particulars	Quarter ended 31-06-2023 (Unaudited)	Quarter ended 31-03-2023 (Audited)	Quarter ended 30-06-2022 (Unaudited)	Year Ended 31-03-2023 (Audited)
1	Total Income from Operations	4.14	6.11	4.20	21.23
2	Net Profit / (Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary items)	(2.19)	(1.22)	(14.26)	(21.72)
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	(2.19)	(1.22)	(14.26)	(21.72)
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	(3.27)	(0.24)	(14.77)	(21.07)
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	0.00	0.00	0.00	0.00
6	Equity Share Capital	1370.00	1370.00	1370.00	1370.00
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-	2107.32
8	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) -- 1. Basic: 2. Diluted:	0.001 0.001	0.02 0.02	(0.04) (0.04)	0.17 0.17

Note:  
a) The above is an extract of the detailed format of Quarterly Consolidated Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Standalone and Consolidated Financial Results are available on the websites of the Stock Exchange at [www.bseindia.com](http://www.bseindia.com) and the company at [www.ratnagroup.co.in](http://www.ratnagroup.co.in).  
b) The Turnover for the Quarter ended 30th June, 2023 is ₹ 8.46 lakhs, Profit before tax is ₹ 1.50 lakhs and Profit after tax is ₹ 2.21 lakhs on stand-alone basis.

For, Ratnabhum Developers Limited,  
Sd/-  
Kaiven Shah  
Chairman and Managing Director  
DIN: 01887130

Place: Ahmedabad  
Date: 11-08-2023

DHARMAJ CROP GUARD LIMITED	
Regd. Office - Plot No. 408 to 411, Kerala DDC Estate, Off NH-8, At: Kerala, Ta: Bavli, Ahmedabad-382228.	
Website: <a href="http://www.dharmajcrop.com">www.dharmajcrop.com</a> , email: <a href="mailto:info@dharmajcrop.com">info@dharmajcrop.com</a> , CIN: L24100GJ2015PLC081941	
NOTICE OF THE 99th ANNUAL GENERAL MEETING AND INFORMATION ON E-VOTING	
1.	Notice is hereby given that the 99th Annual General Meeting ("AGM") of the Company will be held through Video Conferencing / Other Audio-Visual Means ("VC facility") on Monday, September 04, 2023 at 11.30 a.m. (IST), in compliance with applicable provisions of the Companies Act, 2013 and the Rules made thereunder and the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI Listing Regulations"), read with General Circulars / Notifications issued by the Ministry of Corporate Affairs ("MCA") and SEBI (collectively referred to as "applicable circulars"), to transact the businesses as set out in the notice calling the AGM. Members will be able to attend the AGM through VC facility or view the live webcast of the AGM at <a href="https://instameet.linkintime.co.in">https://instameet.linkintime.co.in</a> . Members participating through the VC facility shall be deemed to be present at the AGM and their presence shall be reckoned for the purpose of quorum.
2.	In compliance with the applicable circulars, the Notice convening the AGM and the standalone financial statements for FY2022-23, along with Board's Report, Auditors' Report and other documents required to be attached thereto, have been sent through only email on Friday, August 11, 2023 to all the Members of the Company whose email addresses are registered with the RTA / Company / Depository Participant(s). The aforesaid documents are also made available on the Company's website at <a href="http://www.dharmajcrop.com">www.dharmajcrop.com</a> , website of the Stock Exchanges, i.e. BSE Limited and National Stock Exchange of India Limited at <a href="http://www.bseindia.com">www.bseindia.com</a> and <a href="http://www.nseindia.com">www.nseindia.com</a> respectively and on the website of Link Intime India Private Limited ("Link Intime") at <a href="https://instavote.linkintime.co.in">https://instavote.linkintime.co.in</a> . The physical copies of the Annual Report will be sent to those members who will request for the same.
3.	Instruction for remote e-voting and e-voting during AGM: • The Company is providing to its members facility to exercise their right to vote on resolutions proposed to be passed at the AGM by electronic means i.e. Remote e-voting through 'InstaVote' and E-voting during the AGM through 'InstaMeet'. • The Company has engaged the services of 'Link Intime' as the agency to provide e-voting facility. • Members may cast their votes remotely, using the electronic voting system of 'InstaVote' of Link Intime during the period mentioned herein below ("remote e-voting"). • Further, the facility for voting through electronic voting system will also be made available at the AGM and members attending the AGM through VC facility who have not cast their vote(s) by remote e-voting and are otherwise not barred from doing so shall be eligible to vote through e-voting system during the AGM. • The members who have cast their vote(s) by remote e-voting may also attend the AGM but shall not be entitled to cast their vote(s) again at the AGM. • Information and instructions for participating through VC facility and the process of e-voting are provided in the Notes forming part of the Notice convening AGM. • The remote e-voting facility will be available during the following period: Commencement of remote e-voting: 9.00 a.m. (IST) on Friday, September 01, 2023 End of remote e-voting: 5.00 p.m. (IST) on Sunday, September 03, 2023 • The remote e-voting module shall be disabled by Link Intime for voting thereafter. Once the vote on a resolution is cast by the shareholder, the shareholder shall not be allowed to change it subsequently. A person, whose name is recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the depositories as on the cut-off date i.e. Monday, August 28, 2023 only shall be entitled to avail the facility of remote e-voting as well as e-voting at the AGM. • Any person who acquires shares of the Company and becomes a Member of the Company after sending of the Notice and holding shares as on the cut-off date i.e. Monday, August 28, 2023, may obtain the login ID and password by sending a request at <a href="mailto:enotices@linkintime.co.in">enotices@linkintime.co.in</a> . However, if the person is already registered with Link Intime for remote e-voting, then such person can use existing user ID and password for casting their vote.
4.	Manner of registering / updating KYC details including email addresses by Members: Members holding shares in dematerialised mode can register/update their KYC details including email-id with the Depository Participants with whom they maintain their demat account.
5.	Process for procuring user id and password for e-voting for those shareholders whose email id's are not registered are as under: Members holding shares held in demat mode, please provide DPID - CLID (16 digit DPID + CLID or 16 digit beneficiary ID), Name, client master or copy of consolidated account statement, self-attested scanned copy of PAN card and AADHAR to <a href="mailto:enotices@linkintime.co.in">enotices@linkintime.co.in</a> . In case of any queries, you may contact the helpdesk numbers P: +91 22 49186000 (Ext: 2505) or send a request to Mr. Rajiv Ranjan, Assistant Vice President - E-voting, Link Intime India Pvt. Ltd. at <a href="mailto:enotices@linkintime.co.in">enotices@linkintime.co.in</a> . Members are requested to note the following contact details for addressing their queries / grievances, if any: M's. Link Intime India Pvt. Ltd. Registrar and Share Transfer Agent 5th Floor, 506 to 508, Amarnath Business Centre - 1 (ABC-1), Beside Gala Business Centre, Nr. St. Xavier's College Corner, Off C/G Road, Ellisbridge, Ahmedabad - 380006. E-mail: <a href="mailto:mt.helpdesk@linkintime.co.in">mt.helpdesk@linkintime.co.in</a>

For Dharmaj Crop Guard Limited  
Malvika Bhadreshbhai Kapasi  
Company Secretary and Compliance Officer  
ACS52602

Place : Ahmedabad  
Date : 12-08-2023

Godrej Industries Limited				
CIN : L24241MH1988PLC097781				
Regd. Office: Godrej One, Pirojshanagar, Eastern Express Highway, Vikhroli (E), Mumbai 400 079.				
Tel : 022- 25188010 / 20 / 30; Fax : 022- 25188066				
website : <a href="http://www.godrejindustries.com">www.godrejindustries.com</a> , Email Id: <a href="mailto:investor@godrejinds.com">investor@godrejinds.com</a>				
EXTRACT OF UNAUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2023				
(Amounts in ₹ Crore)				
Particulars	Quarter Ended	Quarter Ended	Quarter Ended	Quarter Ended
	30-Jun-23 Unaudited	31-Mar-23 Audited (refer note 4)	30-Jun-22 Unaudited	31-Mar-23 Audited
Total Income from Operations	4,505.66	4,852.11	4,024.55	16,740.25
Net Profit for the period before Tax and Share of Profit of Equity Accounted Investees (after Exceptional and / or Extraordinary items #)	241.11	470.12	274.92	1,285.11
Net Profit after Tax (after Exceptional and / or Extraordinary items #)	291.41	562.16	257.60	1,420.64
Net Profit After Tax (after Exceptional and / or Extraordinary items #) attributable to the owners of the Company	178.06	300.08	203.95	974.78
Total Comprehensive Income for the period (Comprising Profit) for the period (after tax) &				
Other Comprehensive Income (after tax) attributable to the owners of the Company	156.20	308.51	254.65	1,118.38
Paid-up Equity Share Capital (Face value - ₹. 1 per share)	33.66	33.66	33.66	33.66
Reserves excluding Revaluation Reserve as shown in the audited Balance Sheet				7,950.62
Earnings per share (In ₹.) (Not Annualised)				
(a) Basic	5.29	8.91	6.06	28.96
(b) Diluted	5.29	8.91	6.06	28.95

# Exceptional items are adjusted in the statement of profit and loss in accordance with Ind-AS.

Key numbers of Unaudited Standalone Financial Results				
(Amounts in ₹ Crore)				
Particulars	Quarter Ended	Year Ended		
	30-Jun-23 Unaudited	31-Mar-23 Audited (refer note 4)	30-Jun-22 Unaudited	31-Mar-23 Audited
Turnover (Net Sales)	767.64	900.54	1,048.77	4,487.96
Profit / (Loss) before Tax and Exceptional Items	(27.88)	(25.75)	58.28	232.57
Exceptional Items	-	-	-	-
Profit / (Loss) Before Tax	(27.88)	(25.75)	58.28	232.57
Profit / (Loss) After Tax	(27.88)	(25.75)	58.28	232.57
Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) &				
Other Comprehensive Income (after tax)	(28.29)	(26.15)	57.87	230.95
Paid up Equity Share Capital	33.66	33.66	33.66	33.66
Reserves (excluding Revaluation Reserves)	1,655.15	1,682.73	1,507.87	1,682.73
Capital Redemption Reserve	31.46	31.46	31.46	31.46
Debt Redemption Reserve	-	-	-	-
Securities Premium	925.14	925.14	922.60	925.14
Net worth	1,611.09	1,638.68	1,463.82	1,638.68
Outstanding Net Debt	6,334.63	6,009.01	6,321.05	6,009.01
Debt/Equity Ratio	3.75	3.50	4.10	3.50
Debt Service Coverage Ratio	0.73	0.66	1.28	1.23
Interest Service Coverage Ratio	0.94	0.96	1.77	1.69
Earning per Equity Share (EPS) -				
Basic EPS	(0.83)	(0.77)	1.73	6.91
Diluted EPS	(0.83)	(0.76)	1.73	6.91

Notes:

- The above Statement of unaudited financial results which are published in accordance with Regulation 33 and 52 of the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015, as amended, have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meetings held on August 11, 2023. The financial results are in accordance with the Indian Accounting Standards (Ind-AS) as prescribed under section 133 of the Companies Act, 2013 read with the relevant rules thereunder. The above results have been reviewed by the Statutory Auditors of the Company who have issued an unmodified opinion vide their review reports thereon.
- During the quarter ended June 30, 2023, the Godrej Properties Limited (subsidiary of Godrej Industries Limited) has acquired control of one of its joint venture by giving exit to its joint venture partners. Consequently, fair value gain upon re-measurement of Group's existing investments have been recorded under the head other income.
- Godrej Projects Development Limited ("GPDL"), a wholly owned subsidiary of the Godrej Properties Limited (subsidiary of Godrej Industries Limited), for one of its projects, Godrej Summit in Gurgaon, which was completed in phases in 2017 & 2018, recently appointed an external expert to undertake a detailed independent assessment of a quality issue discovered in the project. This assessment identified the presence of chloride in the concrete used in the project, which, when in contact with water, leads to corrosion of steel reinforcement. The external experts further advised that with the required repair and maintenance framework, the building is expected to perform as per its intended design life. Accordingly, an estimated amount of ₹.155 crore towards repair, maintenance, customer claims, or any ancillary costs has been provided in the unaudited financial results of the Group for the quarter ended June 30, 2023 and approved by the Board of Godrej Properties Limited. GPDL believes that it has the ability to claim against the contractors who constructed Godrej Summit. GPDL has also made an offer to buy back units or provide rentals to all the unit holders of the project and will account for the buyback if and when the intending customers execute the relevant documentation with GPDL.
- The figures for the quarter ended March 31, 2023 are the balancing figures between the audited figures in respect of the full financial years and the published year to date figures upto the third quarter of that financial year.

By Order of the Board  
For Godrej Industries Limited

N. B. Godrej  
Chairman & Managing Director  
DIN: 00066195

Place: Mumbai  
Date : August 11, 2023

THE BUSINESS DAILY.

FINANCIAL EXPRESS

FOR DAILY BUSINESS.



# ધર્મજ ક્રોપ ગાર્ડ લિમિટેડ

રજી. ઓફિસ: પ્લોટ નં-408 થી 411, કેરળ GIDC એસ્ટેટ, NH-8ની બહાર, મું: કેરળ, તા.: બચ્ચા, અમદાવાદ-382220.  
વેબસાઇટ: www.dharmajcrop.com, ઇમેઇલ: info@dharmajcrop.com, CIN: L24100GJ2015PLC081941

## ૦૯મી વાર્ષિક સામાન્ય સભાની નોટિસ અને ઈ-વોટિંગ અંગેની માહિતી

- આથી નોટિસ આપવામાં આવે છે કે કંપની ની 9મી વાર્ષિક સામાન્ય સભા ("ઓછોમ") સોમવાર, 04 સપ્ટેમ્બર, 2023 ના રોજ સવારે 11.30 વાગ્યે (IST) વીડિયો કોન્ફરન્સિંગ / અન્ય ઓનિલાઇન-વિઝ્યુઅલ માધ્યમે ("વીસી સુવિધા") માધ્યમથી, કંપની અધિનિયમ, 2013 અને તેના હેઠળ બનાવેલ નિયમો અને સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સિરિંગ ઓવિલોયન્સ અને ડિસ્કવોગર જરૂરીયાતો) હેઠલેનું, 2015 ("સેબી સિરિંગ રેગ્યુલેશન્સ") ની લાગુ જોગવાઈઓનું પાલન કરીને, સામાન્ય પરિપત્રો / સૂચનાઓ જે, ડોપેસ્ટ બાબતેના મંગલચ ("એમસીએ") અને સેબી દ્વારા જારી કરાયેલા પરિપત્રો (સામૂહિક રીડે "લાગુ લાગુ પરિપત્રો") અનુસાર ઓછોમમાં આવશે, ઓછોમ બોલાવતી નોટિસમાં નિર્ધારિત વ્યવસાયોના વ્યાજવંતો કરવા માટે. સભ્યો વીડિયો કોન્ફરન્સિંગ સુવિધા દ્વારા ઓછોમમાં હાજરી આપી શકશે અને <https://instameet.linkintime.co.in> પર ઓછોમનું લાઇવ વેબકાસ્ટ જોઈ શકશે. વીસી સુવિધા દ્વારા ભાગ લેનારા સભ્યો ઓછોમમાં હાજર હોવાનું માનવામાં આવશે અને તેમની હાજરી હોરનામ લેવું માટે ગણવામાં આવશે.
- લાગુ પડતા પરિપત્રોના અનુસાર, ઓછોમ બોલાવતી નોટિસ અને નાણાકીય વર્ષ 2022-23 માટેના એકલ નાણાકીય વિવેકનો, બોર્ડના અહેવાલ, ઓડિટરના અહેવાલ અને તેની સાથે જોડવાના જરૂરી અન્ય દસ્તાવેજો, શુક્રવારે એપ્રિલ 11, 2023 ના રોજ, કંપનીના તમામ સભ્યો કે જેમના ઈમેલ એડ્રેસ આરટીએ / કંપની/ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ(ઓ) સાથે નોંધાયેલા છે. તેઓને માત્ર ઇમેઇલ દ્વારા મોકલવામાં આવ્યા છે ઉપરોક્ત દસ્તાવેજો કંપનીની વેબસાઇટ [www.dharmajcrop.com](http://www.dharmajcrop.com) , સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ, એટલે કે બીએસઈ લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ અનુક્રમે [www.bseindia.com](http://www.bseindia.com) અને [www.nseindia.com](http://www.nseindia.com) તથા. લિંક ઇન્ટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની વેબસાઇટ ("લિંક ઇન્ટાઇમ") <https://instavote.linkintime.co.in> પર પણ ઉપલબ્ધ છે. વાર્ષિક અહેવાલની ભૌતિક નકલો તે સભ્યોને મોકલવામાં આવશે જેઓ તેના માટે વિનંતી કરશે.
- ઓછોમ દરમિયાન વિશેષ ઈ-વોટિંગ અને ઈ-વોટિંગ માટેની સૂચના:
  - કંપની તેના સભ્યોને ઇલેક્ટ્રોનિક માધ્યમથી ઓછોમમાં પસાર કરવા માટે પ્રસ્તાવિત કરાશે પરંતુ મત આપવાના તેમના અધિકારોને ઉપયોગ કરવાની સુવિધા પૂરી પાડી રહી છે.
  - કંપનીએ ઈ-વોટિંગની સુવિધા પૂરી પાડવા માટે ઓછોમની તરીકે "લિંક ઇન્ટાઇમ"ની સેવાઓનો લાભ લીધો છે.
  - નોંધે દર્શાવેલ સમસ્યાઓ દરમિયાન ("લિંક ઈ-વોટિંગ") દરમિયાન લીક ઈન્ટાઇમની "ઈન્ટરલોક"ની ઇલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમને ઉપયોગ કરીને સભ્યો તેમને મત આપી શકે છે.
  - વ્યક્તિ, ઇલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમ દ્વારા મતદાન કરવાની સુવિધા ઓછોમમાં અને વીડિયો કોન્ફરન્સિંગ સુવિધા દ્વારા ઓછોમમાં હાજર રહેલા સભ્યોને પણ ઉપલબ્ધ કરાવામાં આવશે જેમણે વિશેષ ઈ-વોટિંગ દ્વારા તેમને મત આપ્યો નથી અને વિશેષ ઈ-વોટિંગનો લાભ લીધો નથી તે લોકો ઓછોમ દરમિયાન ઈ-વોટિંગ સિસ્ટમ દ્વારા મતદાન માટે લાયક ગણાશે.
  - જે સભ્યોએ વિશેષ ઈ-વોટિંગ દ્વારા તેમને મત આપ્યો છે તેઓ પણ ઓછોમમાં હાજરી આપી શકે છે પરંતુ તેઓ ઓછોમમાં ફરીથી તેમને મત આપવા માટે કક્કાર નથી.
  - વીડિયો કોન્ફરન્સિંગ સુવિધા દ્વારા ભાગ લેવા માટેની માહિતી અને ઈ-વોટિંગની પ્રક્રિયા ઓછોમ બોલાવતી નોટિસને ભાગ બનતી નોંધેમાં આપવામાં આવી છે.
  - વિશેષ ઈ-વોટિંગ સુવિધા નીચેના સમસ્યાઓ દરમિયાન ઉપલબ્ધ રહેશે:
    - વિશેષ ઈ-વોટિંગની સત્ક્રમણ: શુક્રવાર, સપ્ટેમ્બર 01, 2023ના રોજ સવારે 9.00 વાગ્યે (IST)
    - વિશેષ ઈ-વોટિંગનો અંત: રવિવાર, 03 સપ્ટેમ્બર, 2023ના રોજ સાંજે 5.00 વાગ્યે (IST)
  - વિશેષ ઈ-વોટિંગ મેક્યુલ ત્યારપછી મતદાન માટે લિંક ઈન્ટાઇમ દ્વારા ઇન-કોન્ફરન્સિંગ કરવામાં આવશે. એવન્ય સેક્યુરિટી દ્વારા ઠરાવ પર મત આપવામાં આવે તે પછી, સેક્યુરિટીને તે પછીથી બોલાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. કટ-ઓફ તારીખ એટલે કે સોમવાર, એપ્રિલ 28, 2023ના રોજ જેનું નામ સભ્યોના રજિસ્ટરમાં અથવા ડિપોઝિટરી દ્વારા જાળવવામાં આવેલા લાભદાયી માલિકોના રજિસ્ટરમાં નોંધાયેલું છે તે જ વિશેષ ઈ-વોટિંગની સુવિધા મેળવવા તેમજ ઓછોમમાં ઈ-વોટિંગ માટે કક્કાર રહેશે.
  - ઓછોમ વ્યક્તિ કે જે કંપનીના રોજ મેળવે છે અને નોટિસ મોકલવા પછી અને કટ-ઓફ તારીખ એટલે કે સોમવાર, એપ્રિલ 28, 2023ના રોજ રોજ રાખ્યા પછી કંપનીના સભ્ય બને છે, તે [enotices@linkintime.co.in](mailto:enotices@linkintime.co.in) પર વિનંતી મોકલીને લેડિન આઈડી અને પાસવર્ડ મેળવી શકે છે. જો વ્યક્તિ પહેલાથી જ વિશેષ ઈ-વોટિંગ માટે લિંક ઈન્ટાઇમમાં નોંધાયેલ હોય, તે આવી વ્યક્તિ પોતાનો મત આપવા માટે તેના હાલના યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરી શકે છે.
- સભ્યો દ્વારા ઈમેલ એડ્રેસ સહિત KYC વિગતોની નોંધણી/અપડેટ કરવાની રીત: કોમ્પ્યુટર/મોબાઇલ ફોન પર ધરાવતા સભ્યો કોમ્પ્યુટર/મોબાઇલ ફોન પર તેમની KYC વિગતો નોંધણી/અપડેટ કરી શકે છે.
- જે સેક્યુરિટીના ઈમેલ આઈડી નોંધાયેલા નથી તેમને ઈ-વોટિંગ માટે યુઝર આઈડી અને પાસવર્ડ મેળવવા માટેની પ્રક્રિયા નીચે મુજબ છે:
  - કોમ્પ્યુટર/મોબાઇલ ફોન પર ધરાવતા સભ્યો, ટૂંકા કરીને [enotices@linkintime.co.in](mailto:enotices@linkintime.co.in) ને DPID - CLID (16 અંકની DPID + CLID અથવા 16 અંકની લાભદાયી ID), નામ, કલામન્ટ મારકર અથવા એકાઉન્ટ રેકોર્ડ ની નકલ, પાન કાર્ડની સ્વ-પ્રમાણિત સ્કેન કરેલી નકલ અને આધાર ની નકલ પ્રદાન કરે જે તમારી પાસે હોઈ પ્રશ્નો હોય તો, તમે ટેલિફોનિક નંબરો પી: +91 22 49186000 (બોક્કરના: 2505) પર સંપર્ક કરી શકો છો અથવા શ્રી રાહુલ ઈન્જી, આસિસ્ટન્ટ વાર્ડન પ્રોવિડેન્ટ - ઈ-વોટિંગ, લિંક ઈન્ટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને [enotices@linkintime.co.in](mailto:enotices@linkintime.co.in) પર વિનંતી મોકલી શકો છો.
  - સભ્યોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમના પ્રશ્નો/ગરિબાદો જો હોઈ હોઈ તો, તેના નિરાકરણ માટે નીચે આપેલા સંસ્થામાં પર સંપર્ક કરે.
  - લિંક ઈન્ટાઇમ ઇન્ડિયા પ્રા. લિ. રજિસ્ટ્રાર અને સેક ટ્રાન્સક્ટર એન્ડ સેક ટ્રાન્સક્ટર 5મો માળ, 506 થી 508, અમરનાથ મિલિટેસ સેન્ટર - 1 (ABC-1), ગુલા વિજયન સેન્ટરની વ્યવસ્થા, નં. સેન્ટ ટ્રેડિંગ ઈસ્ટેટ બોમ્બે, સેન્ટ્રલ સેક્ટર બહાર, એરિસ/બચ્ચા, અમદાવાદ - 380006.
  - ઈ-મેઇલ: [rnt.helpdesk@linkintime.co.in](mailto:rnt.helpdesk@linkintime.co.in)

ક્રમ: DHARMAJ  
તારીખ: 12-08-2023

ધર્મજ ક્રોપ ગાર્ડ લિમિટેડ  
SD/  
માવલિકા ભદ્રામણી કપારી  
કંપની સેક્રેટરી અને કમ્પ્લાયન્સ ઓફિસર  
(ACS 52002)



Assurance

Extract Of

Sl. No.	PARTICULARS
1	Gross Written Premium
2	Net Written Premium
3	Profit Before Tax
4	Profit After Tax
5	Solvency Ratio (Theoretical)
6	Net Worth
7	Earning Per Share (Absolute Figures)

Note : 1. The above figures are subject to the audit of the accounts by the Chartered Accountants and the Stock exchange.  
2. Above financial figures are subject to the audit of the accounts by the Chartered Accountants and the Stock exchange.  
3. The above figures are subject to the audit of the accounts by the Chartered Accountants and the Stock exchange.

Place: Mumbai

24x7 - Toll Free  
1800-200-0000

www.new

Head Office